

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૧/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૦ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, ૩૮૫ લીટર દેશી દારૂ, ૨૨૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૨ બોટલ બીયર અને ૩૭૭ બીયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૨ કેસ કરી ૨૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૨,૬૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ગાડીનો કાય તોડી ચોરી:-

સમાચાર યાદી નં.૧૧૪/૧૭

માધવપુરા : ગૌરાંગભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે.પ્લોટ નં-૯૪૬/૧, સેક્ટર-૭ સી, ગાંધીનગર) એ તા.૧૬/૧/૧૭ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૧/૧૭ બપોરનાં ૧/૧૫ થી ૧/૩૦ વાગ્યા દરમિયાન માધવપુરા એડવાન્સ પ્લાઝા, સ્વામીનારાયણ મંદીરની સામે રોડ ઉપર પોતાની ગાડી પાર્ક કરી હતી. દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ ડ્રાઇવર સાઇડનાં પાછળના દરવાજાનો કાય તોડી, કારની પાછળની સીટમાં મુકેલ બે બેગ કે જેમાં બે લેપટોપ તથા એક આઇબોલ કંપનીનો મોબાઇલ ફોન, પાવરબેંક તથા અન્ય જરૂરી દસ્તાવેજ મળી કુલ રૂપિયા ૬૪,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી અજીતસિંહ નારસિંહ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૧૫/૧૭

વેજલપુર : ધર્મેન્દ્રભાઈ કનુભાઈ માલીયા (રહે,નંદધામ સોસાયટી, ભાવના ટેનામેંટ પાસે વાસણા) એ તા.૧૬/૧/૧૭ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૧/૧૭ રાતનાં ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે સોસાયટીનાં પાર્કિંગમાં પોતાની ફોર વ્હીલ ગાડી સેવરોલેટ જીજી.૦૧.સી.પી.૨૩૭૦ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ તા.૧૩/૧/૨૦૧૭ ના કલાક ૯/૩૦ વાગ્યા દરમિયાન ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.કોડીયાતર ચલાવે છે.

મેઘાણીનગર : રાહુલભાઈ રોહિતભાઈ સોલંકી (ઉ.વ.૨૨)(રહે, વનમાળી સોસાયટી, શારદા સ્કૂલની પાછળ, કલાપીનગર, મેઘાણીનગર) એ કોઈ અગમ્ય કારણસર તા.૧૬/૧/૧૭ ના કલાક ૭/૩૦ વાગ્યા પહેલાં કોઈપણ સમયે પોતાના ઘરે છાજલીનાં લોખંડનાં સળીયા સાથે પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી દિલીપસિંહ ગંભીરસિંહ ચલાવે છે.

બાપુનગર : પરેશભાઈ ભાનુપ્રસાદ જોષી (ઉ.વ.૪૦)(રહે,મનહરનગર સોસાયટી વિભાગ-૧, કૃષ્ણ વિદ્યાલય સામે, બાપુનગર) એ કોઈ અગમ્ય કારણસર તા.૧૫/૧/૧૭ રાતના ૧૦/૦૦ થી તા.૧૭/૧/૧૭ સવારનાં ૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે બાપુનગર, આનંદ ફ્લેટની સામે, શિવમ ફ્લેટ ખાતે છતના પાઇપ સાથે વાયરો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રકાશકુમાર વિરચંદભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.